

યુઝરનેમ અને મોબાઈલ નંબર બદલો.

ટીચર લોગીન પાસવર્ડ મેળવો

SASGUJARAT


HELP MODULE



રાજ્યમાં કેટલાક શિક્ષકોના મોબાઈલ નંબર પર પાસવર્ડ મળેલ નથી અથવા લોગીન થવામાં મુશ્કેલી અનુભવે છે એ બાબત ધ્યાનમાં લઈ આ એક અગત્યનું અપડેટ આપેલ છે. આપ આપનો મોબાઈલ નંબર અને યુઝરનેમ બંને સુધારી શકો છો એ માટે આ માર્ગદર્શિકાનો ધ્યાનથી અભ્યાસ કરવો ત્યારબાદજ સુધારો કરવો.

1. મારી શાળામાં મારી પ્રોફાઈલમાં મોબાઈલ નંબર માં ભુલ છે તો શું કરવું.

જો આપનો ડેટા અનલોક હોય તો શાળા લોગીનમાં માહિતી ઉમેરવી માં જઈ આપની વિગત એડીટ કરી આપનો નંબર સુધારી શકો છો જો ડેટા લોક હોયતો આપના તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને જાણ કરી આપનો ડેટા અનલોક કરાવો. તાલુકા લોગીનમાં માહિતી ઉમેરવી માં શિક્ષકની માહિતીમાં જઈ લોક અનલોક બટન પર ક્લિક કરી અનલોક કરાવો. પછી શાળામાંથી સુધારો કરી શકશો.




લોક અનલોક
બટન
(તાલુકા
લોગીન)

2. મોબાઈલ નંબર સાચો છે અથવા અપડેટ કર્યો પણ યુઝરનેમ અલગ છે અથવા લોગીનમાં મુશ્કેલી છે....

શાળામાં શિક્ષકની માહિતીમાં નંબર સાચો હોય તો આપ આપનો યુઝરનેમ 1 વાર બદલી જે મોબાઈલ નંબર સાચો છે તેને યુઝરનેમ બનાવી શકો છો તેના માટે શાળા લોગીનમાં શિક્ષકના નામની સામે એક કી મુકી છે આ કી એકજ વાર કામ કરશે ત્યારબાદ આપ યુઝરનેમ બદલી શકશો નહીં માટે સાચો નંબર અપડેટ કરીનેજ આ કી દબાવવી તો તરત જે મોબાઈલ નંબર સિસ્ટમમાં નાખેલ હશે તે યુઝરનેમ બની જશે અને પાસવર્ડ મોબાઈલ પર આવી જશે. ત્યારબાદ યુઝરનેમ માત્ર રાજ્ય કક્ષાએથીજ બદલી શકાશે આ કી 30 નવેમ્બર બાદ હટાવી દેવાશે.

શાળા લોગીનમાં માહિતી ઉમેરવીમાં શિક્ષકની માહિતીમાં જાઓ

જેને યુઝરનેમ અને મોબાઈલ નંબર અલગ છે તેનેજ આ ચાવી દેખાશે.

ડાયસ કોડ	યુઝરનેમ અપડેટ	ક્રિયા
24210200101	98*****37	   
		   

આ ચાવી પર ક્લિક કરતાંજ યુઝરનેમ મોબાઈલ નંબર મુજબ અપડેટ થઈ જશે.

આ ચાવી માત્ર એક વાર કામ આપશે માટે કાયમી નંબર નેજ યુઝરનેમ બનાવો. ત્યારબાદ પાસવર્ડ ના આવે કે ભુલી જાઓ તો લોગીન પેજ પર રીસેટ પાસવર્ડ દ્વારા પાસવર્ડ મેળવી શકો છો